

૬.૪ જૈન ધર્મનું વિજ્ઞાન: બાર પ્રતિજ્ઞાઓ

જગતના સદળા પદાર્થો પ્રસંગો, કે ઘટનાઓ કુદરતના ચોક્કસ નિયમોને આધીન છે. સજુવ સૃષ્ટિ, પશુ પંખી, પ્રાણીજગત પણ તે પોતાના ચોક્કસ નિયમો પ્રમાણે ચાલે છે. કુદરતી શક્તિના ઓત સ્વરૂપ પાણી, અર્દિન, વાયુ અને પૃથ્વીને પણ જો નિયંત્રિત કરાય તો માનવ જગતને ઉપકારી બને છે નહિંતર વિનાશકારી બને છે.

વર્તમાન વિશ્વના વિકાસ પાછળ માનવની બુદ્ધિશક્તિ જેમ કારણભૂત ગણાય છે તેમ અદ્યાત્મજગતમાં આંતરિક ગુણોના વિકાસ પાછળ પણ માનવની સદળી શક્તિઓ ઉપર સદ્ગારાલંબનો, સદવિચારો, પવિત્ર આચારોનું નિયમન થાય તો અવશ્ય તે માનવમાંથી મહા માનવ બની શકે છે અને તે માટે પરમકરણાવાળા જ્ઞાની મહાપુરુષોએ માનવ જીવનના આંતરિક શાણગારો અને સુશોભનો માટે બાર પ્રતિજ્ઞાઓ (શ્રાવક જીવનના બાર વ્રતો) બતાવવામાં આવ્યા છે.

૧) મોટી હિંસાનો ત્યાગ (પહેલું અણુવ્રત)

જાણી જોઈને નિરપરાધી હાલતા ચાલતા ત્રસ જીવોની હિંસા કરીશ નહિં. અને બીજા પાસે કરાવીશ નહિં. કોઈપણ નાના-મોટા ગમતા-અણગામતા સર્વજીવોને અભય આપવા માટે આ વ્રત સ્વીકારવાનો છે. આ વ્રતથી અવૈર-અભયની સિદ્ધિ થાય છે. **નિયમ:-** કોઈની સાથે લડાઈ ઝડપ કરીશ નહિં અને કોઈપણ જીવોની હત્યા હું કરીશ નહિં.

૨) મોટા જૂઠનો ત્યાગ (બીજુ અણુવ્રત)

કોઈપણ પ્રકારનું જૂઠ, કપટ, દંબ સેવીશ નહિં. કરતા હોય તેની અનુમોદન કરીશ નહિં અને ભૂતકાળમાં મારા આત્માએ જે કોઈ જૂઠના ભાવો કર્યા હોય તેનો સારો પશ્ચાતાપ કે નિંદા કરીશ. આ વ્રતથી વચન સિદ્ધિ પ્રગાટે છે. તેમજ સર્વ મંત્રો યોગો વગેરે સિદ્ધ થાય છે. રોગ શોક વગેરેનો નાશ થાય છે અને સ્વર્ગ અને મોક્ષના સુખો આવી મળે છે. **નિયમ:-** કોઈનો વિશ્વાસદાત કરીશ નહિં અને કોઈની હત્યા થાય કે મોટું નુકશાન થાય તેવું જૂઠ બોલીશ નહિં.

૩) મોટી ચોરીનો ત્યાગ (ત્રીજુ અણુવ્રત)

કોઈપણ પ્રકારની ચોરી કરવી નહિં કરાવવી નહિં અને ચોરીને અનુમોદન આપવું નહિં. ચોરીનો ત્યાગ કરવાથી લોકમાં વિશ્વાસ, પ્રશંસા, ધન, ધાન્યાદિ સમૃદ્ધિની વૃદ્ધિ, મનની સ્થીરતા અને નિર્ભયતા પ્રગાટે છે. આ વ્રતમાં અણાહકનું લેવું, બીજા કોઈનું પડાવી લેવું, માલિકને પૂછ્યા વગાર લેવું તે સર્વ જડ કે ચેતન વસ્તુઓની માલિકી કરવી તે આ વ્રતના ભંગ બરાબર થાય છે. **નિયમ:-** માલિકની કોઈપણ વસ્તુ કહ્યા વગાર લઈશ નહિં અને વ્યવહારમાં કહેવાતી ચોરી કરીશ નહિં.

૪) મોટા અબ્ધમનો ત્યાગ (ચોથું અણુવ્રત)

વિષય વાસનાથી અલિષ્ટ રહેવા માટે આજે તાતી જરૂર છે. આ શરીર માત્ર ભોગ ભોગવવા માટે નથી મળ્યું પણ દિવ્ય ઉટામ વસ્તુઓની પ્રાપ્તિ માટે મળ્યું છે. સજાતીય કે વિજાતીય કોઈપણ વ્યક્તિ સાથે સરાગ સંબંધ, વચન, દષ્ટિ, સહવાસ કે સંયોગ કરવો તે આ વ્રતના ભંગ બરાબર છે. આ વ્રતનું પાલન કરવાથી આરોગ્ય, સમૃદ્ધિ, કીર્તિ, સંકલ્પ શક્તિ વધતી જાય છે અને સત્ત્વ ગુણની પ્રાપ્તિ થાય છે. **નિયમ:-** સ્વપણી સંતોષ અને પરસ્સીનો ત્યાગ કરીશા. વિજાતીય સાથે દેહમર્યાંદા રાખીશ.

૫) મોટી માલિકી કે મૂર્ખાંનો ત્યાગ (પાંચમું અણુવ્રત)

સંસારની સઘળી ઉપાધિઓ દરછાઓના ટગાલામાં છે, જેમ દરછાઓ ઓછી થાય, માલિકી ઓછી થાય, મમત્વ ઓછું થાય તો જ સાચું સુખ અને શાંતિ મળે અને તે માટે ઓછામાં ઓછી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓથી ચલાવી લેવાની સાચિક વૃત્તિ આ વ્રતના પાલનથી પ્રગાટે છે.

ધન, ધાન્ય, ચોકડ રકમ, દાગીના, મિલકત વગેરે ઉપરથી માલિકીનો ત્યાગ કરવો તે આ પ્રતિજ્ઞા છે. આ પ્રતિજ્ઞાથી સંતોષ સુખ, લક્ષ્મીની સ્થિરતા, લોક પ્રશંસા અને ચિત્તની પ્રસંગતા પ્રાપ્ત થાય છે અને દુર્ગાતિ બંધ થાય છે.

નિયમ:- અમુક ધન, મિલકત, દાગીના, મિલકત સિવાય વધારાના ધનને ધર્મ માર્ગ વાપરીશા.

૬) દિશા મર્યાંદા ગુણવ્રત (પહેલું)

મારો આત્મા ચૌદે રાજલોકના સર્વક્ષેપોમાં અનંતી વખત જન્મ મરણ કરી ચૂક્યો છે પરંતુ અયોગી બનવું અને સ્થિર બનવું તે આ વ્રતનો ભાવ છે.

ચાર દિશા, વિદિશા, અને ઉપર નીચેની એમ દસે દિશામાં કારણ વગાર કયાંચ જવું આવવું નહિં તે આ વ્રતની પ્રતિજ્ઞા છે. આ વ્રતના સ્વીકારથી પોતાના ક્ષેત્ર સિવાયના તમામ ક્ષેત્રોના તમામ પાપો સાથેનો સંબંધ રદ થાય છે અને અભયદાન અપાય છે. આ વ્રતથી આત્મગુણોની સ્થિરતા થાય છે.

નિયમ:- ભારત બહાર કારણ વગાર અમુક વખતથી વધારે જરૂર નહિં અથવા અમુક રાજ્યો સિવાય બહાર જરૂર નહિં.

૭) પરિભોગ મર્યાંદા ગુણવ્રત (બીજું)

જગતના સર્વ ભોગ વિલાસો, શોખો અને કહેવાતી સુંદર વસ્તુઓ અનેક વખત આ જીવે ભોગવી છે વારંવાર ભોગવી છે. છતાંચ સંતોષ કે તૃપ્તિ થઈ નથી. તેના નિયંત્રણ માટે ભોગ ઉપભોગ સંબંધિત સર્વ પાપ વ્યાપારોનો ત્યાગ કરવાનો હોય છે.

આ પ્રતિજ્ઞામાં સાચિત કે આરંભ સહિતની સઘળી પાપ પ્રવૃત્તિઓના ત્યાગ માટે આહાર, વેપાર, વ્યવહાર અને સંબંધમાં નિયંત્રણ મૂકવાનું છે. આ વ્રતના પાલનથી અનેક અનેક જણાતા નહિં જણાતા

દોષો, પાપો સહજતાથી છૂટી જાય છે. આત્મ શક્તિનો ઉદ્ઘાટ થાય છે અને ગુણોનો સારો વિકાસ થાય છે.

નિયમ:- ૨૨ અભદ્રય, ૩૨ અનંતકાય(કંદમૂળ) નો ત્યાગ કરીશ અને ચૌદ નિયમોનું યથાશક્ય પાલન કરીશ.

૮) અનર્થ દંડનો ત્યાગ ગુણવ્રત (ગ્રીજું)

અજ્ઞાનવશ જીવે અનેક પાપો અને તેના ભાવો કર્યા છે તેમાં આર્ત્યાન, રૌદ્ર ધ્યાન, પ્રમાદ, હિંસા, સેક્સ વગોરેના લેવા-દેવા વગારના માગ્ર વચનથી કે શોખથી અનેક અનેક કર્માના ટગાલા બાંધ્યા છે મતલબ કે, પાપો કોઈક કરે અને તેના હિસ્સેદાર આપણે બનીએ, તેથી વગાર જરૂરિયાતના દોષો અને પાપોનો ત્યાગ કરવાનો ભાવ છે. આ વ્રતના પાલનથી માનસિક અશાંતિ દૂર થાય છે, દુર્ગાતિ અટકી જાય છે અને સર્વ પ્રકારની મોક્ષ માટેની અનુકુળતાઓ પ્રાપ્ત થતી જાય છે. **નિયમ:-** મનોરંજન ટી.વી., વિડીયો ચેનલ વગોરે જોવા ઉપર અમૃક મર્યાદા બાંધીશ અને મહાહિંસાના કે સેક્સ વગોરેની પ્રવૃત્તિઓમાં રસ લઈશ નહિં.

૯) સામાયિક વ્રત (પહેલું)

સામાયિક કરવું એટલે અંતરના સદ્ગુણોને વિકસવા દેવા માટેનું સ્થાન આપવું જે શાંત છે, ઉપશાંત છે તે સામાયિક ભાવમાં છે, સાચું સામાયિક સમતામાં છે અને તે સદ્ગુણા ઉતારવા માટે રોજ એક અડતાલીસ મીનીટ સામાયિકના ઉપકરણ સાથે કરવું જરૂરી છે. **નિયમ:-** અઠવાડિયામાં ઓછામાં ઓછું એક સામાયિક કરીશ અથવા ધર્મ પુસ્તકોનું એક કલાક વાચન કરીશ.

૧૦) દેશાવગાંસિક વ્રત (બીજું)

સામાયિક કરતાં વિશેષ પ્રકારે સંપૂર્ણ દિવસ વિરતિમાં રહેવા માટેની પ્રક્રિયા છે. સદ્ભાવોને અંતરમાં ઉતારવા માટે તે ઘૂટવા જરૂરી છે. તેથી આ વ્રતમાં સવાર સાંજ પ્રતિક્રમણ અને છૂટક આઠ સામાયિક કરવાની હોય છે. સંસાર સંબંધી વ્યવહાર વ્યાપારનો ત્યાગ કરવાનો હોય છે અને એકાશન કરવાનું હોય છે.

નિયમ:- વર્ષમાં બે કે તેથી વધુ વાર ઉપરોક્ત નિયમ ગ્રહણ કરીશ.

૧૧) પૌષ્ટય વ્રત (ગ્રીજું)

અજ્ઞાન અને મોહવશ સંસારના સઘળા ભાવોનું જે પૌષ્ટણ કર્યું છે તેના સઘળા દોષો, દુર્ગ્યુણોનો ત્યાગ કરવા માટે સાધુ જીવનની જેમ જ જીવન જીવવાની તાલીમ લેવાની છે. સંસારના વ્યવહાર, વ્યાપારના સંબંધોથી મુક્તા થઈને આત્મ ગુણોને પામવાનું છે. આ પૌષ્ટયવ્રતના પાલનથી આત્માની શક્તિ સમૃદ્ધિનો ખ્યાલ આવે છે, સહનશક્તિ ખુબ જ વિકસે છે અને સર્વ જીવો સાથે મૈત્રી, આત્મીયતા પ્રગાટે છે.

નિયમ:- વર્ષમાં ઓછામાં ઓછી એક વાર પણ પૌષ્ટની આરાધના અપ્રમત ભાવે કરીશ.

૧૨) અતિથિ સંવિભાગ વ્રત (ચોયું)

અતિથિ સંવિભાગ વ્રતમાં સાધુ સાધ્વીજી ભગવંતોને સેવા ભક્તિ કરવાની હોય છે. આગાલા દિવસે પૌષ્ઠ્રવ્રત, ઉપવાસ અને બીજે દિવસે એકાસણાનું પચ્ચક્ખાણ કરવાનું હોય છે. આ વ્રતના પાલનથી દાસપણું, દુર્ગાતિ, દુર્ભાગ્ય અને સઘળા દોષો આપોઆપ છૂટી જાય છે. આરંભ અને પરિગ્રહના સઘળા પાપો પણ છોડી દેવાના હોય છે. **નિયમ:-** વર્ષમાં એક વખત પૂજય સાધુ-સાધ્વીજી ભગવંતની ભક્તિ-સેવા કરીશા અથવા સંયોગ ન મળે તો શ્રાવક-શ્રાવિકાની ભક્તિ કરી અતિથિ સંવિભાગ કરીશા.

ઉપરોક્ત બાદેય પ્રતિજ્ઞાની વિશેષ જાળકારી વિસ્તારથી મેળવવા લાઇબ્રેરી વિભાગમાં જૈન

આચાર અને નીતિ શાસ્ત્રના વિષયોમાં કિલક કરવું.

jainuniversity.org